https://archive.org/details/bk1136/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી પીરાણા સતપંથનો ખાત્મો શામાટે નથી થતો?

realpatidar.com

એક પેચીદો સવાલ છે અને તેના જવાબો પણ એવાજ પેચીદા હોઈ શકે છે જેને પચાવવા આપણા સૌને માટે અઘરા છે પણ જરૂરી છે. વરસોથી ઘર કરી ગયેલા રોગને મટાડવા માટે નાછૂટકે કડવી દવાઓનું સેવન કરવું અનિર્વાય હોય છે. તો ચાલો આપણે ઉપરના પ્રશ્નનને ધ્યાનમાં રાખીને તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ અને જવાબોની સમીક્ષા કરીએ.

Full Library on https://realpatidar.com/library

આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીની ભીષ્મ પ્રતિજ્ઞા:

જે વ્યક્તિની આપણે પૂજા કરીએ છીએ, જે પૂજનીય વ્યક્તિનો આપણે આદ્ય સુધારક તરીકે કેન્દ્રીય સમાજ, ઝોન સમાજથી લઈને દરેક ઘટક સમાજોમાં ફોટો ટીંગાડીને તેને માન ભરી નજરે નિહાળીએ છીએ તે વ્યક્તિએ સતપંથ બાબતમાં શું કહ્યું હતું તેનો વિચાર તો આપણે કરતા જ નથી. તો પછી તે વ્યક્તિને આદ્ય સુધારક તરીકે નિહાળવાની શું જરૂરત છે? શું તેમને જ માત્ર પીરાણા સતપંથ ધર્મ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ હતી? ના, તેમને ચિંતા હતી સમગ્ર કચ્છ કડવા પાટીદારની કે પીરાણા સતપંથ ને લઈને આખી જ્ઞાતિ અધોગતિ તરફ જઈ રહી હતી. તેમને ચિંતા હતી જ્ઞાતિની ઓળખ હિંદુ તરીકેની મટી ને એક મુમના મુસલમાન તરીકેની થઈ જવા જઈ રહી હતી. જ્ઞાતિને સતપંથ માંથી છોડાવીને સમગ્ર કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જ્ઞાતિના મૂળ હિંદુ ધર્મમાં પાછી લઈ આવવાની પ્રતિજ્ઞા એમણે લીધી હતી.

આજથી લગભગ સો એક વરસ પહેલાં આદ્ય સુધારક નારાયણજી રામજી લીંબાણીએ સતપંથ બાબતમાં બોલતાં કહ્યું હતું કે **"કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને હિન્દુપણાથી દુર કરનાર એ પાપી પાખંડી પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી દુર કરવાના સર્વે પ્રયત્નો હું કરીશ અને તેમ કરતાં તેમ મારા આ જન્મારામાં ન થયું તો ફરી પાછો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ લઈને તે પાપી પીરાણા સતપંથનું જ્ઞાતીમાંથી નિકંદન કાઢી નાખીશ"**

આવી ભીષ્મ પ્રતિજ્ઞા નારાયણજી બાપાએ તે સમયે લીધી હોવા છતાં આપણે તેમ (જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો) કરી નથી શકતા તેના કારણો શું હોઈ શકે છે? તેની વિસ્તૃત ચર્ચા આપણે આજે કરવાની છે. તેનું ચિંતન અને મનન આપણે આજે કરવાનું છે. જ્ઞાતિમાંથી સતપંથને ઉખેડી ફેંકવા માટે ચાર ચાર વખત જ્ઞાતિમાં સનાતની મુહિમો થવા છતાં હજી સુધી આપણને સંપૂર્ણ સફળતા મળતી નથી. શા માટે નથી મળતી? તેની વિગત વાર ચર્ચા આપણને આજે કરવાની છે. આ ચર્ચા અગત્યની છે એટલી જ જરૂરી પણ છે કારણકે હવે પછી આપણી સનાતની જ્ઞાતિમાં અને સનાતની સમાજમાં આવનાર પેઢીને પીરાણા સતપંથ વાળો પ્રશ્ન મુકીને નથી જવું. હવે

realpatidar.com

https://archive.org/details/bk1136/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી પીરાણા સતપંથનો ખાત્મો શામાટે નથી થતો?

realpatidar.com

આ એક પેચીદો સવાલ છે અને તેના જવાબો પણ એવાજ પેચીદા હોઈ શકે છે જેને પચાવવા આપણા સૌને માટે અઘરા છે પણ જરૂરી છે. વરસોથી ઘર કરી ગયેલા રોગને મટાડવા માટે નાછુટકે કડવી દવાઓનું સેવન કરવું અનિર્વાય હોય છે. તો ચાલો આપણે ઉપરના પ્રશ્નનને ધ્યાનમાં રાખીને તેના જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ અને જવાબોની સમીક્ષા કરીએ.

આદ્ય સુધારક શ્રી નારાયણજી રામજી લીંબાણીની ભીષ્મ પ્રતિજ્ઞા:

જે વ્યક્તિની આપણે પૂજા કરીએ છીએ, જે પૂજનીય વ્યક્તિનો આપણે આદ્ય સુધારક તરીકે કેન્દ્રીય સમાજ, ઝોન સમાજથી લઈને દરેક ઘટક સમાજોમાં ફોટો ટીંગાડીને તેને માન ભરી નજરે નિહાળીએ છીએ તે વ્યક્તિએ સતપંથ બાબતમાં શું કહ્યું હતું તેનો વિચાર તો આપણે કરતા જ નથી. તો પછી તે વ્યક્તિને આદ્ય સુધારક તરીકે નિહાળવાની શું જરૂરત છે? શું તેમને જ માત્ર પીરાણા સતપંથ ધર્મ સાથે વ્યક્તિગત દુશ્મનાવટ હતી? ના, તેમને ચિંતા હતી સમગ્ર કચ્છ કડવા પાટીદારની કે પીરાણા સતપંથ ને લઈને આખી જ્ઞાતિ અધોગતિ તરફ જઈ રહી હતી. તેમને ચિંતા હતી જ્ઞાતિની ઓળખ હિંદુ તરીકેની મટી ને એક મુમના મુસલમાન તરીકેની થઈ જવા જઈ રહી હતી. જ્ઞાતિને સતપંથ માંથી છોડાવીને સમગ્ર કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને જ્ઞાતિના મૂળ હિંદુ ધર્મમાં પાછી લઈ આવવાની પ્રતિજ્ઞા એમણે લીધી હતી.

આજથી લગભગ સો એક વરસ પહેલાં આદ્ય સુધારક નારાયણજી રામજી લીંબાણીએ સતપંથ બાબતમાં બોલતાં કહ્યું હતું કે **"કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને હિન્દુપણાથી દુર કરનાર એ પાપી પાખંડી પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી દુર કરવાના સર્વે પ્રયત્નો હું કરીશ અને તેમ કરતાં તેમ મારા આ જન્મારામાં ન થયું તો ફરી પાછો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ લઈને તે પાપી પીરાણા સતપંથનું જ્ઞાતીમાંથી નિકંદન કાઢી નાખીશ"**

આવી ભીષ્મ પ્રતિજ્ઞા નારાયણજી બાપાએ તે સમયે લીધી હોવા છતાં આપણે તેમ (જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો) કરી નથી શકતા તેના કારણો શું હોઈ શકે છે? તેની વિસ્તૃત ચર્ચા આપણે આજે કરવાની છે. તેનું ચિંતન અને મનન આપણે આજે કરવાનું છે. જ્ઞાતિમાંથી સતપંથને ઉખેડી ફેંકવા માટે ચાર ચાર વખત જ્ઞાતિમાં સનાતની મુહિમો થવા છતાં હજી સુધી આપણને સંપૂર્ણ સફળતા મળતી નથી. શા માટે નથી મળતી? તેની વિગત વાર ચર્ચા આપણને આજે કરવાની છે. આ ચર્ચા અગત્યની છે એટલી જ જરૂરી પણ છે કારણકે હવે પછી આપણી સનાતની જ્ઞાતિમાં realpatidar.com અને સનાતની સમાજમાં આવનાર પેઢીને પીરાણા સતપંથ વાળો પ્રશ્ન મુકીને નથી જવું. હવે

https://archive.org/details/bk1136/page/n3/mode/1up

આરપારની લડાઈ લડવાનો સમય આવી ગયો છે. યા તો જ્ઞાતિમાંથી પીરાણા સતપંથને કાયમને માટે નાબુદ કરવાનો છે અથવા તો પીરાણા સતપંથ મુક્ત સમાજ બનાવીને સતપંથીઓને આખરી પ્રસ્તાવ (ultimatum) આપવાનો છે. નાતની સર્વોચ્ચ સંસ્થાએ (કેન્દ્રીય સમાજે) એવો ફતવો બહાર પાડવો જોઈએ કે ફલાણી તારીખ સુધી જે સતપંથના ભાઈઓને પીરાણા સતપંથ નો અને સતપંથ સમાજનો સંપૂર્ણ પણે ત્યાગ કરીને સમાજના સનાતની પ્રવાહમાં ભળી જવું હોય તો ભળી જઈ શકે છે, ત્યાર પછી એવા લોકો માટે સનાતની નાતમાં જોડાવાના દરવાજા કાયમને માટે બંધ કરી દેવામાં આવશે. મુકરર કરેલી તારીખ પછી તે સતપંથ ના પરિવારોને આકાશ-પાતાળ એક કરવા છતાં સનાતની નાતમાં ભેળવવામાં આવશે નહિ. જેને ભળવું હોય તે અત્યારે ભળી જાય, પાછળથી કોઈ કાળે ભેળવવામાં આવશે નહિ. આવો આખરી પ્રસ્તાવ કેન્દ્રીય સમાજને પારિત કરવાનો સમય હવે આવી ગયો છે.

હવે મૂળ વાત ઉપર આવીએ કે આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી સતપંથનો સંપૂર્ણ પણે સફાયો શા માટે નથી થતો. તેના મુખ્ય કારણો નીચે પ્રમાણે ના છે.

૧. ધાર્મિક કટ્ટરતાની ખામી:

જેવી રીતે ભારતમાં હિન્દુઓની પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સનાતની ભાઈઓની છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત કરવું હશે તો ભારતમાં રહેતા તમામ હિન્દુઓએ હિન્દુ ધર્મ પ્રત્યે ધાર્મિક કટ્ટરતા દાખવી જેટલી જરૂરી છે તેટલી અથવા તો તેનાથી પણ વધારે ધાર્મિક કટ્ટરતા આપણી સનાતની કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને એક સાચા સનાતની હિંદુ તરીકે સતપંથ વિરૂદ્ધ ધાર્મિક કટ્ટરતા દાખવવી જરૂરી છે. આવી ધાર્મિક કટ્ટરતા આવે ક્યાંથી? બજારમાંથી વેચાતી તો તે મળતી નથી. તો પછી કટ્ટરતા લાવવી ક્યાંથી? તે માટે દરેક સનાતની ભાઈએ પોતાની ફરજ સમજીને જાતે જ કટ્ટરતા અપનાવવી પડશે. દરેક સનાતનીને પોતે સ્વયમ ધાર્મિક રીતે કટ્ટર રહેવું પડશે. આપણી સમાજે સતપંથ સનાતન બાબતે બનાવેલા નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. સનાતની સિદ્ધાંતોને દરેક સનાતનીએ દ્રઢતાપૂર્વક વળગી રહેવું અત્યંત જરૂરી છે. પણ તેમ આપણે અત્યારે કરી શકતા નથી તે આપણી કમજોરી છે. સનાતની સિદ્ધાંતોને વળગી રહેવાની જવાબદારી ફક્ત આમ સનાતની ભાઈઓની જ નથી પણ ઉપરી હરોળમાં બેઠેલા તમામ મોવડીઓની પણ એટલી જ જવાબદારી બને છે. હાલ નો તાજેતરનો જ દાખલો આપણે લેશું તો સતપંથના કાકાઓ આપણા ધાર્મિક સંકુલોમાં આવ્યા જે મજુરી વગર તો આવી ન શક્યા હોત. આપણે જ ઠરાવો પારિત કરેલા જ છે કે પીરાણા સતપંથના કોઈ પણ પ્રોગ્રામમાં જવું અથવા તો પીરાણા સતપંથના લોકોને આપણા

https://archive.org/details/bk1136/page/n4/mode/1up

ઘરે (આપણા ધાર્મિક, શૈક્ષણિક, સામજિક સંકુલોમાં) બોલાવવા નિષેધ ફરમાવવામાં આવેલ છે. છતાં આપણે સતપંથના કાકાઓને આપણા ધાર્મિક સંકુલોમાં આવવા આડકતરી રીતે મંજૂરી આપી તે આપણી ધાર્મિક કટ્ટરતામાં ખામી જણાઈ આવે છે. આ ભૂલ આમ જોઇશું તો કાંઈજ નથી થયું એવું કહીને ભૂલ કરનાર લોકો ભલે પોતાનો બચાવ કરી રહ્યા હોય પણ આવી ભૂલો થકી સમાજના સામાન્ય નાગરિકોમાં એટલી મોટી ગેરસમજણ ફેલાય છે અને પરિણામ સ્વરૂપે આપણી સતપંથ સામેની લડાઈમાં મોટી ઢીલાશ આવી જાય છે. અને તેથી આપણી સનાતની લડાઈ ઉપર અવળી અસર પડે છે. સતપંથીઓ આવાં ગતકડાં કરવામાં તો માહિર છે. આપણને સાવચેતી રાખવાની જરૂરત છે.

realpatidar.com

૨. મવાળવાદીઓ દ્વારા સતપંથીઓને છાવરવાની પ્રવૃત્તિઓ:

ક્યારેક તો સતપંથી ભાઈઓ આપણને હેરાન નથી કરતા તેનાથી વધારે હેરાનગતિ આપણને આ મવાળવાદીઓ કરતા હોય છે. આમ તો આ મવાળવાદીઓ પોતાને સનાતની તરીકે ઓળખાવે છે પણ કોણ જાણે કેમ આ લોકોને સનાતની સિદ્ધાંતોમાં બાંધ છોડ કરવાની પેરવીઓ તેઓ હંમેશાં કરતા રહીને સનાતની લડાઈને ઢીલી કરવામાં તેઓ પાશવી આનંદ લેતા રહે છે. આવા લોકોને આપણે ઓળખી શકતા નથી અને ઓળખી લેવા છતાં તેની સામે કોઈ શિક્ષાત્મક/દંડાત્મક પગલાં લઈ નથી શકતા તે આપણી નબળાઈ દર્શાવે છે.

૩. સગાંવાદ સામે સનાતની ભાઈઓના ગુડા ટેકણાં:

સામાન્ય પણે આવા લોકો પોતાને સનાતની તરીકે ઓળખાવે છે અને તેઓ સનાતની જ છે પણ ખરા પણ જ્યાં સગાંવાદનો પ્રશ્ન આવે છે ત્યારે તેઓ લાચાર બની જાય છે અને કાયદામાં છીંડાં ગોતવાનો સતત પ્રયત્ન કરીને સનાતની લડાઈ ને નબળી પાડવામાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે મદદ રૂપ થતા હોય છે. જાણે સગાં તરીકે સતપંથના ભાઈઓ જોડે સંબંધો જાળવવાનો ઠેકો સનાતની ભાઈઓએ જ લીધો હોય. શું સતપંથી સગાંઓને બાંધ છોડ કરવાની જવાબદારી નથી. આ સનાતની સગાંઓની નબળી કડી છે તેમાં સતપંથી સગાં હમેશાં ફાયદો ઉઠાવતા હોય છે. જુના સંબંધો બંધાઈ ગયા હોય તે તો ઠીક છે પણ નવેસરથી સતપંથી જોડે સામાજિક સબંધો બાંધવા તે નરી મૂર્ખાઈ જ છે. આ એક ધાર્મિક કટ્ટરતા ની ખામી છે તેને જો દૂર કરવામાં આવે તો સતપંથ સામેની લડાઈ આપણે જીતવામાં સફળ જલ્દીથી થઈ શકીએ એમ છે. અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી સતપંથને સંપૂર્ણ પણે નાબૂદ કરવાનું નારાયણજી બાપાના સપનાને સાકાર કરી શકીએ. આડકતરી રીતે સતપંથી સાથે નો સગાંવાદ પીરાણા સતપંથ ને જીવંત

realpatidar.com

રાખવામાં પ્રાણવાયુ પૂરો પાડે છે અને પરિણામ સ્વરૂપે જ્ઞાતિમાંથી સતપંથ કાયમને માટે નાબૂદ થતો નથી. સગાંવાદ થી સતપંથને સતત જીવતદાન મળતું રહે છે.

realpatidar.com

૪. લડાઈ તમે લડો એ અમારું કામ નથી:

સતપંથ સામેની લડાઈ તમે લડો એવી નબળી માનસિકતા બહોળા સનાતની ભાઈઓમાં ઘર કરી ગઈ છે. ધાર્મિક લાડાઈ કોઈ એકલ દોકલને લડવાનું કામ નથી. તે તો સામૂહિક રીતે સમસ્ત સનાતનીઓ ને લડવી પડે, તો જ આપણે તે લડાઈ જીતી શકીએ. દરેક સનાતની, તે પોતાની જવાબદારી સમજીને જો આ લડાઇ લડે તો કોઈ સતપંથીની મજાલ નથી કે તેઓ આપણી સામે ટકી શકે. આખરે, સતપંથીને મજબૂર થઈને આપણી સાથે સનાતની પ્રવાહમાં જોડાઈ જવું જ પડે અને આપણે જ્ઞાતિમાંથી સતપંથને કાયમને માટે નાબૂદ કરી શકીએ તેમાં બે મત નથી.

૫. પલાયનવાદ વૃત્તિ અને આક્રમકતા નો અભાવ:

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતીનો આ એક મહા ભયંકર રોગ કહી શકાય જે આપણું એક નકારાત્મક (negative) પાસું છે. જ્યારે સતપંથ સામે જજુમવાની વાત આવે છે ત્યારે આ જ્ઞાતિનો માણસ લડાઈ લડવા માટે જરૂરી ત્વરિત નિર્ણય નથી લેતો. પછી કરશું, શું જલ્દી છે હમણાં, આપણી લીટી લાંબી કરો, પહેલાં સમાજ વિકાસની વાતો કરો. સતપંથ સામે પછી પણ લડી લેવાશે આવી ડાહી, ડાહી સૂફિયાણી વાતો કરવા લાગી જાય છે. પણ તેને ખબર નથી કે આ લડાઈ છેલ્લા ૨૦૦ વરસથી ચાલુ છે, છતાં પણ આપણે સંપૂર્ણ રીતે જીતી શક્યા નથી તેમાં આપણી પલાયનવાદ વૃત્તિ પણ એટલી જ જવાબદાર છે જેટલાં અન્ય કારણો જવાબદાર છે. કોઈ પણ લડાઈ હોય ભલે પછી તે લડાઈ સતપંથ સામેની હોય કે અન્ય લડાઈઓ હાય, તે લડાઈઓ તો જ જીતી શકાય જો આપણે આક્રમક વૃતિ (મારક વૃત્તિ) અપનાવીએ. મુસલમાન ની જેમ "**મારો સાલે કો**" જેવી મારક વૃત્તિ (KILLERS INSTINCT) આપણને પણ અપનાવવી જોઈએ તો જ આપણે સતપંથને આપણી જ્ઞાતિમાંથી નાબુદ કરીને નારાયણજી બાપાના સપનાને સાકાર કરી શકીશું અન્યથા તે શક્ય નથી.

૬. આપણી ત્રણે મુખ્ય સંસ્થાઓનો સતપંથ સામે સમન્વયતાથી એક અવાજે કામ કરવાનો અભાવ:

આપણી કેન્દ્રીય સમાજ (શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ) અને તેના દ્વારા સમય સમયાંતરે ઊભી કરવામાં આવેલ બે ધાર્મિક સંસ્થાઓ શ્રી વાંઢાય ઉમિયા માતાજી સંસ્થાન અને શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન દેસલપર, જો સતપંથ સનાતન મુદ્દે એકજૂટ થઈને એક આવાજે કામ નહીં કરે તો સતપંથને આપણે આપણી જ્ઞાતિમાંથી નાબૂદ કરી શકવાના નથી તે દેખીતી

realpatidar.com

વાત છે. જ્યારે સતપંથ–સનાતન ની વાત હોય ત્યારે આપણે જ બનાવેલા સનાતની સિદ્ધાંતોમાં બાંધ–છોડ જો થતી રહેશે તો સતપંથ સામેની લડાઈ જીતવામાં આપણને સમય લાગવાનો છે તે હકીકત છે. જેમ સમય વધારે જશે તેમ જ્ઞાતિમાંથી સતપંથને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાનું કામ અઘરૂં બનતું જશે. આપણો રવૈયો જો આવો જ રહ્યો તો જેમ અનેક પેઢીઓ નીકળી ગઈ અને અનેક પેઢીઓ ભવિષ્યમાં હજી નીકળી જવાની છે તે હકીકત છે. હવે આપણને જ્ઞાતિમાંથી આ પ્રશ્ન ભવિષ્યની પેઢીને નથી દઈ જવો. તે માટે અત્યારની વર્તમાન પેઢીને આરપારની લડાઇ લડી લેવી પડશે એવું મારૂં માનવું છે.

realpatidar.com

૭. આપણી ત્રણે સંસ્થાઓ ના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓને જ્ઞાતિના અને સમાજના સાચા ઇતિહાસનું જ્ઞાન હોવાનો અભાવ:

કોઈ પણ સંસ્થાના હોદ્દેદારોને હોદ્દો ધારણ કરતા પહેલાં તે સંસ્થાના અને જ્ઞાતિના સાચા ઈતિહાસનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. જ્ઞાન હોવું એટલા માટે જરૂરી છે કે સતપંથ બાબતે આપણી સનાતની સંસ્થાઓની શું જવાબદારીઓ બને છે તેનાથી તેઓ સતત વાકેફ રહે અને સમય સમયાંતરે જ્ઞાતી અને સંસ્થાઓના હિતમાં સનાતન ધર્મ બાબતે યોગ્ય નિર્ણયો લઈને જ્ઞાતિમાંથી સતપંથ ને નાબૂદ કરવા માટે સદાય તત્પર અને કટિબદ્ધ રહે. જ્ઞાતિ અને સમાજના સાચા ઇતિહાસ નું પૂરું જ્ઞાન સંસ્થાઓના ધુરીણોમાં ન હોવાને લીધે સતપંથ બાબતે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય તેઓ સનાતની ભાઈઓના હિતમાં લઈ નથી શકતા. તે આપણી એક નબળાઈ છે. અનેક કારણોમાં નું આ પણ એક કારણ છે કે આપણે જ્ઞાતિમાંથી સતપંથને નાબુદ નથી કરી શકતા.

૮. સનાતની લડવૈયાઓ ને રક્ષણ પૂરૂં પાડવાનો અભાવ:

સતપંથ ને જ્ઞાતિમાં થી નાબૂદ જો આપણને કરવું હશે તો સતપંથ સામે લડી રહેલા સમાજના સનાતની વીરોને દરેક જાતનું (કાનૂની, આર્થિક અથવા તો અન્ય રીતે) રક્ષણ પૂરૂં પાડવાની જવાબદારી કેન્દ્રીય સમાજ અને તેની અંતર્ગત આવતી તમામ સંસ્થાઓએ લેવી અત્યંત જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને આપણી બે ધાર્મિક સંસ્થાઓએ પીરાણા સતપંથ સામે ની લડાઈમાં મોખરે રહીને તે જવાબદારી સુપેરે પાર પડાવી જરૂરી છે. આપણી બંને ધાર્મિક સસ્થાઓની જવાબદારી બને છે કે તેઓ સનાતની લડવૈયાઓ ને સતપંથ સામે લડવા માટે દરેક જાતનું રક્ષણ પૂરૂં પાડે જેથી સતપંથ સામેની લડાઈ આપણે જીતી શકીએ અને જ્ઞાતિમાંથી સતપંથને આપણે નાબૂદ કરી શકીએ.

realpatidar.com

૯. પરિવારવાદ એક અવરોધ:

ગામે ગામની પોતાની સમાજો હોવા છતાં, પરદેશમાં રહેતા હોય ત્યાં સથાનિક સમાજો હોવા છતાં આપણને પરિવારનો મોહ એટલો બધો છે કે ત્યાં આપણે સતપંથ સનાતનનો મુદ્દો જ ભૂલી જઈએ છીએ. પરિવારોમાં જ્યારે ભેગા થઈએ છીએ ત્યારે સતપંથ સનાતનને મુદ્દે કેન્દ્રીય સમાજે બનાવેલા કાયદાઓને નેવે મૂકી દેતા હોઈએ છીએ. પરિવારના નામે સતપંથના ભાઈઓ જોડે ગુડે બેસીને જમીએ છીએ. આવું બધું થતું હોય ત્યાં જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો કઈ રીતે શક્ય બને? આ સવાલ દરેક સનાતનીએ પોતાની જાતને પૂછવો જોઈએ. પરિવારવાદ ને બળ પૂરું પાડીને આપણે કેન્દ્રીય સમાજની નીતિઓને ઢીલી પાડી રહ્યા છીએ તે દરેક સનાતની ભાઈએ વિચારવું જોઈએ. હજી કેટલાયે પરિવારોએ પોતાની સનાતની તરીકેની ઓળખ કાયમ કરી નથી. આવા પરિવારોમાં લોલમલોલ કુટાય છે. આ બંધ થવું જોઈએ તો જ આપણે જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો કરી શકીશું.

realpatidar.com

૧૦ . VHP, RSS અને ભાજપ તરફથી સતપંથ ને જીવતદાન:

જ્ઞાતિમાંથી સતપંથનો સફાયો શા માટે થતો નથી તેનું હજી એક કારણ આપણે આપી શકીએ. અને તે કારણ છે પીરાણા સતપંથના લોકો પોતાનું ઇમામશાહ વાળું તુત ચાલુ રાખવા માટે પૈસાના જોરે RSS, VHP અને ભાજપ નો સહારો લઈને પીરાણા સતપંથને જીવંત રાખે છે.

આપણી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો આરએસએસ, વીએચપી અને ભાજપ સતપંથને સહારો ન આપ્યો હોત તો સતપંથ વહેલો જ વીંટાઈ ગયો હોત અને આપણી જ્ઞાતિ સતપંથ મુક્ત જ્ઞાતિ વહેલી બની ગઈ હોત. પણ અફસોસ છે કે તેઓ આ વાતને સમજતા નથી. આખરે તેઓ પણ પૈસાને જ ઓળખે છે. બીજું RSS જેવી સંસ્થાઓ પોતાના વિચારોમાં એમ રાચે છે કે પીરાણા સતપંથ વાળા ભાઈઓને અમે મુસલમાન થતાં બચાવીએ છીએ. તેમની ઘર વાપસી અમે કરાવી રહ્યા છીએ. આ VHP ની, આરએસએસ ની અને ભાજપ ની ભ્રાંત કલ્પના છે. સતપંથના ભાઈઓને મુસલમાન થતાં તો બચાવ્યા છે આપણા સુધારક વડીલોએ. જો તેઓ ન હોત તો ક્યારના આપણે સૌ સતપંથ માં રહીને મુમના મુસલમાન બની ગયા હોત.

તેવી જ રીતે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન પણ તેમને સતપંથ બાબતે તેમનો ચુકાદો આપ્યા પછી થોડી ઘણી પણ સતપંથ સામે કડકાઈ બતાવી હોત તો પણ આપણી જ્ઞાતિના સતપંથી ભાઈઓને સતપંથ છોડીને આપણી સાથે ભળી જવા મજબૂર થવું પડત અને તેઓ પીરાણા સતપંથને મુકીને સનાતની થઈ ગયા હોત. અને આપણી જ્ઞાતિમાંથી સતપંથ ને નાબૂદ કરીને આપણી જ્ઞાતિ સતપંથ મુક્ત જ્ઞાતિ બની ગઈ હોત.

realpatidar.com

૧૨. સતપંથ અને સતપંથના ભાઈઓની તરફેણમાં વાતો કવા નું બંધ કરીએ:

realpatidar.com

અમુક કહેવાતા સનાતની ભાઈઓની ખોટી ટેવ હોય છે કે સતપંથમાં આ સારૂં છે, પીરાણામાં તે સારૂં છે તેમ કહીને સનાતની સમાજને અને સનાતનીઓને ઉતારી પડવાની કોશિશ કરતા રહે છે. તેમને એ ખબર નથી કે સનાતન ધર્મ અને સનાતન સમાજ આપણી મા છે. પોતાની મા ગમે તેવી હોય પણ બીજાની મા સાથે તેની સરખામણી કોઈ દિવસ ન કરાય. આવું બોલીને આપણા અમુક સનાતની ભાઈઓ આડકતરી રીતે પીરાણા સતપંથ ને જીવાડવામાં પ્રાણવાયુ પૂરો પાડતા હોય છે. કહેવાય છે કે મતિયા પાટીદારો પણ એક સમયે સતપંથમાં હતા. પણ જ્યારે તેઓને જ્ઞાન થયું કે સતપંથ એક મુસ્લીમ ધર્મનું ફાંટું છે અને તે મતિયા પાટીદાર જ્ઞાતિને લાયક ધર્મ નથી એટલે તેઓએ સામુહિક રીતે સતપંથનો ત્યાગ કર્યો અને ત્યાર પછી સતપંથ તરફ પાછું વાળીને જોયું નથી. આને કહેવાય સાચો ત્યાગ અને સમજણ. પણ કોણ જાણે કેમ આપણે કઈ માટીના ઘડાયેલા છીએ કે ઈમામશાહ બાવો પણ ૫૦૦ વરસમાં આપણને સંપૂર્ણ રીતે મુસલમાન બનાવી ન શક્યો અને આપણે પોતે પણ સતપંથ માંથી વટલાઈને સંપૂર્ણ જ્ઞાતિ સનાતની હિંદુ બની ન શકી. સતપંથ રૂપી થોડી ગણી એઠ તો આપણામાં રહી જ ગઈ. ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી માં ઉમિયા આપણી જ્ઞાતિને સદબુદ્ધિ આપે અને આપણી આખી જ્ઞાતિ પીરાણા સતપંથનો, ઈમામશાહ બાવાનો, સતપંથના શાસ્ત્રોનો અને સતપંથ સમાજનો સદન્તરે ત્યાગ કરીને સમાજના સનાતની પ્રવાહમાં ભળી જાય એવી અભ્યર્થના સાથે મારા આ લખાણને વિરામ આપું છું.

(ભગવાન સૌનું ભલું કરે અને તેની શુરુઆત મારી જ્ઞાતિ થી કરે)

રમેશભાઈ માવજીભાઈ વાગડિયા. બેંગલોર (૧૨.૦૬.૨૦૨૨)

realpatidar.com